

Extra No. 74



सत्यमेव जयते

# The Gujarat Government Gazette

EXTRAORDINARY  
PUBLISHED BY AUTHORITY

Vol. LXV ] MONDAY, JULY 1, 2024 / ASHADHA 10, 1946

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than  
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧લી જુલાઈ, ૨૦૨૪

તારીખ: ૧લી જુલાઈ, ૨૦૨૪ના ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા સન ૨૦૨૪ના ગુજરાત વટહુકમ  
ક્રમાંક: ૧નો ગુજરાતી અનુવાદ આથી સર્વે લોકોની જાણ સારૂ પ્રસિદ્ધ કર્યો છે.

આર. આર. સોલંકી,  
સરકારના નાયબ સચિવ.



વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ,  
સચિવાલય, ગાંધીનગર, તારીખ: ૧લી જુલાઈ, ૨૦૨૪.

**THE GUJARAT LAWS (AMENDMENT OF PROVISIONS) ORDINANCE, 2024**

**GUJARAT ORDINANCE NO. 1 OF 2024.**

**AN ORDINANCE**

*to amend the provisions of the Acts made by the State of Gujarat to give effect to the references to Bharatiya Nyaya Sanhita, 2023, the Bharatiya Nagarik Suraksha Sanhita, 2023 and the Bharatiya Sakshya Adhinyam, 2023 in place of reference to the Indian Penal Code, 1860, the Code of Criminal Procedure, 1973 and the Evidence Act, 1872 in the said Acts.*

ગુજરાત કાયદા (જોગવાઈઓના સુધારા) વટહુકમ, ૨૦૨૪

સન ૨૦૨૪નો ગુજરાત વટહુકમ ક્રમાંક : ૧.

ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ અને પુરાવા અધિનિયમ, ૧૮૭૨ના સંદર્ભને બદલે, ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ના સંદર્ભો અમલમાં મૂકવા માટે ગુજરાત રાજ્યએ કરેલા અધિનિયમોની જોગવાઈઓ સદરહુ અધિનિયમોમાં સુધારવા બાબત વટહુકમ.

ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ નથી;

અને ગુજરાતના રાજ્યપાલને એવી ખાતરી થઈ છે કે સંસદ દ્વારા ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ અધિનિયમિત કરવાને લીધે સન ૨૦૨૩નો ૪૫મો, સન ૨૦૨૩નો ૪૬મો, સન ૨૦૨૩નો ૪૭મો. ગુજરાત કાયદા સુધારવા માટે તાત્કાલિક પગલું લેવાનું તેમને માટે જરૂરી બનાવે તેવા સંજોગો પ્રવર્તે છે;

તેથી, હવે, ભારતના સંવિધાનના અનુચ્છેદ ૨૧૩ના ખંડ (૧)થી તેમને મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, નીચેનો વટહુકમ કરીને પ્રસિદ્ધ કરે છે:-

- ટૂંકી સંજ્ઞા અને આરંભ.-** (૧) આ વટહુકમ ગુજરાત કાયદા (જોગવાઈઓના સુધારા) વટહુકમ, ૨૦૨૪ કહેવાશે.  
(૨) તે તરત જ અમલમાં આવશે.
- ગુજરાત કાયદા હંગામી રીતે સુધારવા બાબત.-** આ વટહુકમના અમલની મુદત દરમિયાન, અનુસૂચિની કોલમ (૪)માં જણાવેલા ગુજરાતના કાયદા, કલમ ૩માં નિર્દિષ્ટ કરેલા સુધારાને અધીન રહીને અમલમાં રહેશે.
- અમુક અધિનિયમનો સુધારો.-** અનુસૂચિની કોલમ (૪)માં ઉલ્લેખેલા અધિનિયમનો, આથી, તેની કોલમ (૫)માં જણાવેલ પ્રમાણમાં અને તે રીતે સુધારવામાં આવે છે.

**અનુસૂચિ**  
(જુઓ કલમ ૨)

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧	૨૦૧૭	૧૫	બિરસા મૂંડા આદિજાતિ યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૧૭	(ક) કલમ ૫૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ રાજ્ય સેવકો” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨(૨૩)ના અર્થ મુજબ રાજ્ય સેવકો” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૨	૧૯૬૦	૨૭	ગુજરાત ખેત-જમીન ટોચમર્યાદા અધિનિયમ, ૧૯૬૦	(ક) કલમ ૨૨માં, પેટા-કલમ (જ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૭૫ અને ૧૭૬ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૧૦ અને ૨૧૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.  (ખ) કલમ ૪૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૧૮૩, કલમ ૨૧૮ અને કલમ ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.  (ગ) કલમ ૪૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૩	૧૯૮૦	૭	ગુજરાત ખેત જંતુ અને રોગ અધિનિયમ, ૧૯૮૦	(ક) કલમ ૧૮માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨૪)ની કલમ ૨૬૨ થી ૨૬૫માં સમાવિષ્ટ જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૮૪ થી ૧૮૬માં સમાવિષ્ટ જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૪	૧૯૫૪	૭૨	ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૪	(ક) કલમ ૮માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨૪)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.  (ખ) કલમ ૧૧માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૫	૨૦૦૮	૨૦	ગુજરાત કપાસીયા (પુરવઠા, વિતરણ, વેચાણ નિયમન અને વેચાણ કિંમત નિર્ધારણ) અધિનિયમ, ૨૦૦૮.	(ક) કલમ ૧૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૬	૧૯૬૩	૩૭	ગુજરાતનો પ્રતિપાલક અધિકરણ અધિનિયમ, ૧૯૬૩	(ક) કલમ ૧૯માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમના પ્રકરણ ૯ના અર્થ મુજબ અને સદરહુ અધિનિયમની કલમ ૧૬૧માં સમાવિષ્ટ “કાયદેસર મહેનતાણું”ની વ્યાખ્યામાં” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના પ્રકરણ ૧૨ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૭	૨૦૧૯	૨૨	ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯	(ક) કલમ ૧૩માં, પેટા-કલમ (૩)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની જોગવાઈઓ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૮	૧૯૫૬	૩૧	ગુજરાત હિન્દુ જાહેર પૂજા સ્થળો (માં પ્રવેશ અધિકૃત) અધિનિયમ, ૧૯૫૬	(ક) કલમ ૭માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૯	૧૯૯૯	૧૧	ગુજરાત માળખાકીય વિકાસ અધિનિયમ, ૧૯૯૯.	(ક) કલમ ૩૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૦	૨૦૦૬	૨૪	ગુજરાત ખાદી અને ગ્રામોદ્યોગ અધિનિયમ, ૨૦૦૬	(ક) કલમ ૩૨માં, પેટા-કલમ (૩)માં, ખંડ (ખ)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ના પ્રકરણ ૭ની જોગવાઈઓ હેઠળ મેજિસ્ટ્રેટ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ના પ્રકરણ ૭ની જોગવાઈઓ હેઠળ મેજિસ્ટ્રેટ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.  (ખ) કલમ ૩૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૧	૧૯૫૦	૪	ગુજરાત વિલીન રાજ્યો (કાયદા) અધિનિયમ, ૧૯૫૦	(ક) દ્વિતીય અનુસૂચિમાં, ભાગ ૧માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, (સન ૧૯૮૮નો ૫મો)” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૬મો)” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૨	૧૯૯૩	૧૮	ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩	(ક) કલમ ૧૦૨માં,- (૧) ખંડ (ક)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨૪)ની કલમ ૨૦૨ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૨૫ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (૨) ખંડ (ખ)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨૪)ની કલમ ૧૨૫ હેઠળ તપાસ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૪૪ હેઠળ તપાસ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(ખ) કલમ ૨૬૮માં, પેટા-કલમ (૩)માં, ખંડ (ખ)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ના પ્રકરણ-૭ની જોગવાઈઓ હેઠળ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ના પ્રકરણ ૭ની જોગવાઈઓ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.  (ગ) કલમ ૨૭૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦(સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૩	૧૯૫૮	૩૧	ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલ અધિનિયમ, ૧૯૫૭	(ક) કલમ ૧૩માં, પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૬૮ (સન ૧૯૬૮ના ૫મા)ની કલમ ૧૯૫, ૪૮૦ અને ૪૮૨ના તમામ હેતુઓ માટે અને ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ તેની કાર્યવાહીઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમો ૨૧૫, ૩૮૪ અને ૩૮૫ના તમામ હેતુઓ માટે અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ તેની કાર્યવાહીઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૪	૧૯૮૦	૩૨	ગુજરાત દુકાન અને સંસ્થા (કર્મચારી જીવન વીમા) અધિનિયમ, ૧૯૮૦	(ક) કલમ ૧૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૫	૨૦૦૮	૨	ગુજરાત ખાસ મૂડી રોકાણ પ્રદેશ અધિનિયમ, ૨૦૦૮.	(ક) કલમ ૩૯માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૬	૧૯૫૧	૨૫	સૌરાષ્ટ્ર જમીન સુધારણા અધિનિયમ, ૧૯૫૧	(ક) કલમ ૫૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૨, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૭	૧૯૫૩	૨૩	સૌરાષ્ટ્ર ખેતીની જમીન પટા પ્રતિબંધ અધિનિયમ, ૧૯૫૩	(ક) કલમ ૧૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૮	૧૯૫૮	૫૬	મુંબઈ રાજ્ય પોલીસ કમિશનર અધિનિયમ, ૧૯૫૮	(ક) અનુસૂચિમાં, કોલમ ૧માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૬૮ (સન ૧૯૬૮નો ૫મો)” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૬મો)” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧૯	૧૯૫૧	૩૮	મુંબઈ રાજ્ય અનામત પોલીસ દળ અધિનિયમ, ૧૯૫૧	<p>(ક) કલમ ૨માં, ખંડ (ઠ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૬૦ના ૪૫મા, સન ૧૯૮૮ના ૫મા)માં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૧૧માં,</p> <p>(૧) પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ના પ્રકરણ ૮ના હેતુ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ના પ્રકરણ ૧૧ના હેતુ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(૨) પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૦૦ અને ૧૦૩માં સમાવિષ્ટ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૩૮ અને ૪૧માં સમાવિષ્ટ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૨૦	૧૯૬૭	૮	મુંબઈનો ગામની પોલીસ બાબતનો અધિનિયમ, ૧૯૬૭	<p>(ક) કલમ ૧માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)માં તેને સોંપવામાં આવેલ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં તેને સોંપવામાં આવેલ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૨૧	૧૯૫૮	૧૯	ગાંધીધામ (મકાન બાંધકામ વિકાસ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૫૭	<p>(ક) કલમ ૧૬માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ની કલમ ૩૨માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૩માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૨૭ક-માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૨૨	૨૦૦૪	૫	ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ, ૨૦૦૪.	<p>(ક) કલમ ૫૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૨૩	૧૯૬૪	૨૦	ગુજરાત ખેત-ઉત્પન્ન અને ખરીદ-વેચાણ (ઉત્તેજન અને સરલીકરણ) અધિનિયમ, ૧૯૬૩	<p>(ક) કલમ ૩૧-૩-માં, પેટા-કલમ (૫)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૩ના ૨૪)ની કલમ ૧૦૦ની પેટા-કલમો (૪) થી (૮)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૦૩ની પેટા-કલમો (૪) થી (૮)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ખ) કલમ ૫૧૬-માં, પેટા-કલમ (૪)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ગ) કલમ ૫૭માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૨૪	૧૯૫૬	૩	ગુજરાત હવાઈ રજીસ્ટ્રાર્ગો બાબતનો અધિનિયમ, ૧૯૫૫	<p>(ક) કલમ ૩૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમના અર્થ મુજબ” એ શબ્દોને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૩૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમના અર્થ મુજબ” એ શબ્દોને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ગ) કલમ ૪૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દોને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૨૫	૧૯૭૩	૨	ગુજરાત મુલકી સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ, ૧૯૫૫	<p>(ક) કલમ ૧૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૯, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૧૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૨૬	૨૦૧૯	૨૪	ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, ૨૦૧૫	<p>(ક) કલમ ૨માં, ખંડ (ખ)ને બદલે, નીચેનો ખંડ મૂકવો:-  “(ખ) “અધિનિયમ” એટલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૬મો);”</p> <p>(ખ) કલમ ૮માં, પેટા-કલમ (૩)માં, “અધિનિયમની કલમ ૨ના ખંડ (ભ)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડો અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨ના ખંડ (૧)(મ)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા, અક્ષર અને કૌંસ મૂકવા.</p> <p>(ગ) કલમ ૯માં, પેટા-કલમ (૨)માં, “અધિનિયમની કલમ ૨૬૦ની પેટા-કલમ (૧) અથવા કલમ ૨૬૨માં ગમે તે મજકૂર હોય તેમ છતાં, તે અધિનિયમમાં ઠરાવેલી કાર્યરીતિ અને આવી ઈન્સાફી કાર્યવાહીને લાગુ પડે છે તેટલે સુધી તે અધિનિયમની કલમ ૨૬૩થી ૨૬૫ની જોગવાઈઓ અનુસાર સંક્ષિપ્ત રીતે</p>



અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>તેની ઈન્સાફી કાર્યવાહી કરી શકશે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૮૩ની પેટા-કલમ (૧) અથવા કલમ ૨૮૫માં ગમે તે મજકૂર હોય તેમ છતાં, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩માં ઠરાવેલી કાર્યરીતિ અને આવી ઈન્સાફી કાર્યવાહીને લાગુ પડે છે તેટલે સુધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૮૬ થી ૨૮૮ની જોગવાઈઓ અનુસાર સંક્ષિપ્ત રીતે તેની ઈન્સાફી કાર્યવાહી કરી શકશે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ઘ) કલમ ૧૫માં, પેટા-કલમ (૧)માં, “અધિનિયમમાં અથવા ભારતના પુરાવા અધિનિયમ, ૧૮૭૨માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૭મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ચ) કલમ ૧૬માં, પેટા-કલમ (૧)માં, “અધિનિયમમાં અથવા ભારતના પુરાવા અધિનિયમ, ૧૮૭૨માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૭મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(છ) કલમ ૧૮માં, પેટા-કલમ (૫)માં,-</p> <p>(૧) ખંડ (ક)માં, “અધિનિયમની કલમ ૮૨માં ગમે તે મજકૂર હોય તે છતાં” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૨) ખંડ (ખ)માં, “અધિનિયમની કલમો ૮૩થી ૮૫ની જોગવાઈઓ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમો ૮૫ થી ૮૮ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>
૨૭	૧૯૬૨	૧૦	ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧	<p>(ક) કલમ ૯૧માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮નો ૫મો)ની રૂએ ઠરાવેલી રીતે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)થી જોગવાઈ કરેલી રીતે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૧૧૫ઝ-માં, પેટા-કલમ (૭)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી:-</p> <p>“(૭) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૩ હેઠળ કોઈ પણ વ્યક્તિને પોતાની સત્તા કરતાં વધુ કેદની અથવા દંડની સજા કરવાનું પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ માટે કાયદેસર ગણાશે.”</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ગ) કલમ ૧૪૫બ-માં, પેટા-કલમ (૧)માં, ખંડ (ખ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૧૫૩ક અથવા કલમ ૧૭૧ચ અથવા કલમ ૧૭૧છ અથવા કલમ ૫૦૫ની પેટા-કલમ (૨) અથવા પેટા-કલમ (૩) હેઠળ શિક્ષાપાત્ર” એ શબ્દો, આંકડાં અથવા કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૧૮૬ અથવા કલમ ૧૭૩ અથવા કલમ ૧૭૪ અથવા કલમ ૩૫૩ની પેટા-કલમ (૨) અથવા પેટા-કલમ (૩) હેઠળ શિક્ષાપાત્ર” એ શબ્દો, આંકડાં અથવા કૌંસ મૂકવા.</p> <p>(ઘ) કલમ ૧૪૫બ-ને બદલે, નીચેની કલમ મૂકવી:-</p> <p>“૧૪૫બ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૩ હેઠળ આ પ્રકરણ હેઠળ કોઈ ગુના માટે દોષિત ઠરેલી કોઈ પણ વ્યક્તિને પોતાની સત્તા કરતાં વધુ કેદની અથવા દંડની સજા કરવાનું પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ માટે કાયદેસર ગણાશે એવા ફેરફારોને અધીન રહીને, કલમ ૧૪૮ની જોગવાઈઓ આ પ્રકરણ હેઠળના ગુનાઓને લાગુ પડશે અને કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય, આ પ્રકરણ હેઠળના શિક્ષાપાત્ર ગુના માટે કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નહિ.”</p> <p>(ગ) કલમ ૧૪૮માં, પેટા-કલમ (૨)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી:-</p> <p>“(૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં, કલમ ૧૪૮ હેઠળ જોગવાઈ કર્યા પ્રમાણે કલમ ૧૪૭ની પેટા-કલમ (૧)ના ખંડ (ગ) હેઠળ ગુના માટે દોષિત ઠરેલી કોઈ પણ વ્યક્તિને તે સંહિતાની કલમ ૨૩ હેઠળ તેની સત્તા કરતાં વધુ દંડની સજા કરવાનું પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ માટે કાયદેસર ગણાશે.”</p>
૨૮	૧૯૬૩	૨૭	ગુજરાત પશુરોગ (નિયંત્રણ) અધિનિયમ, ૧૯૬૩	<p>(ક) કલમ ૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૨૬માં, પેટા-કલમ (૩)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના ૫મા)થી જોગવાઈ કરેલી રીતે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)થી જોગવાઈ કરેલી રીતે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૨૯	૧૯૫૮	૪૦	ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ, ૧૯૫૮	<p>(ક) કલમ ૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ પ્રમાણે” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૭માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના ૫મા)ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો, આંકડા</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૩૦	૨૦૦૩	૨૪	ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) અધિનિયમ, ૨૦૦૩.	<p>(ક) કલમ ૧૮માં, પેટા-કલમ (૫)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨-જા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૫૬માં,-</p> <p>(૧) પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૨) પેટા-કલમ (૨)માં, “સદરહુ અધિનિયમની કલમ ૨૦૦માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો અને આંકડાને બદલે, “સદરહુ સંહિતાની કલમ ૨૨૩માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો અને આંકડા મૂકવા.</p> <p>(ગ) કલમ ૬૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩ અને ૨૨૮ના અર્થ મુજબ અને કલમ ૧૯૬ના હેતુઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮ અને ૨૬૭ના અર્થ મુજબ અને કલમ ૨૩૩ના હેતુઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ઘ) કલમ ૬૧માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫-મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૩૧	૧૯૬૯	૭	ગુજરાત વિજળી પુરવઠા સંસ્થા (સંપાદન) અધિનિયમ, ૧૯૬૯.	(ક) કલમ ૧૬માં, પેટા-કલમ (૩)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૯૮ (સન ૧૯૯૮ના ૫મા)ની કલમ ૩૨માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૩માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૩૨	૧૯૯૮	૨	ગુજરાતનો ફેરી અને આંતર્દેશીય વહાણ અધિનિયમ, ૧૯૯૮	(ક) કલમ ૧૫-માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૯૮ (સન ૧૯૯૮ના ૫મા)ની કલમો ૩૮૬, ૩૮૭ અને ૩૮૮માં જોગવાઈ કરેલી રીતે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમો ૪૬૧, ૪૬૨ અને ૪૬૫માં જોગવાઈ કરેલી રીતે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૩૩	૨૦૦૩	૮	ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ, ૨૦૦૩	(ક) કલમ ૨૩માં, પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(ખ) કલમ ૨૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૩૪	૨૦૦૩	૨૨	ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૦૩	(ક) કલમ ૭માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;
૩૫	૨૦૧૧	૩	ગુજરાત ગ્રીન સેસ અધિનિયમ, ૨૦૧૧.	(ક) કલમ ૮માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.  (ખ) કલમ ૧૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૩૬	૧૯૫૮	૬૧	ગુજરાત અભ્યસ્ત ગુનેગાર નિર્બંધ અધિનિયમ, ૧૯૫૮.	(ક) કલમ ૨માં, ખંડ (ક)ને બદલે નીચેનો ખંડ મૂકવો:-  “ક) “અધિનિયમ” એટલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૬મો);  (ખ) કલમ ૧૩માં,-  (૧) પેટા-કલમ (૧)માં, “અધિનિયમની કલમ ૧૧૦ હેઠળનું કૃત્ય,” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૨૮ હેઠળનું કૃત્ય” એ શબ્દો અને આંકડા મૂકવા;  (૨) પેટા-કલમ (૨)માં, “અધિનિયમની કલમો ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૫ અને ૧૧૭માં નિયત કરેલી કાર્યરીતિ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમો ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૫ અને ૧૩૬માં નિયત કરેલી કાર્યરીતિ” એ શબ્દો અને આંકડા મૂકવા;  (૩) પેટા-કલમ (૨) હેઠળના પરંતુકમાં, “સંહિતાની કલમ ૧૧૨-માં ઉલ્લેખેલ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૩૧માં ઉલ્લેખેલ” એ શબ્દો અને આંકડા મૂકવા;  (ગ) કલમ ૧૮માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા) હેઠળ જવાબદાર” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા) હેઠળ જવાબદાર” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ધ) અનુસૂચિ ૧ને બદલે નીચેની અનુસૂચિ મૂકવી:-</p> <p style="text-align: center;">“અનુસૂચિ ૧ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા) હેઠળના ગુના અનુસૂચિ (જુઓ કલમ ૨(ઝ))</p> <p>કલમો</p> <p>૧૭૮. ખોટા સિક્કા બનાવવા બાબત.</p> <p>૧૭૮. ખોટા ભારતીય સિક્કા બનાવવા બાબત.</p> <p>૧૮૧. ખોટા સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવા અથવા વેચવા બાબત.</p> <p>૧૮૧. ખોટા ભારતીય સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવા અથવા વેચવા બાબત.</p> <p>૧૮૧. ખોટા સિક્કા બનાવવા માટેનું સાધન અથવા સામગ્રી કબજામાં રાખવા બાબત.</p> <p>૧૭૯. સિક્કો બનાવટી છે એવી જાણ સાથે પોતાના કબજામાં હોય તે સિક્કો બીજાને આપવા બાબત.</p> <p>૧૭૯. ભારતીય સિક્કો બનાવટી છે એવી જાણ સાથે પોતાના કબજામાં હોય તે સિક્કો બીજાને આપવા બાબત.</p> <p>૧૮૦. પોતાના કબજામાં આવ્યો હોય ત્યારે તે બનાવટી હોવાનું પોતે જાણતી હોય એવી વ્યક્તિએ કોઈ બનાવટી સિક્કો પોતાના કબજામાં રાખવા બાબત.</p> <p>૧૮૦. પોતાના કબજામાં આવ્યો ત્યારે તે બનાવટી હોવાનું પોતે જાણતી હોય એવી વ્યક્તિએ કોઈ ભારતીય સિક્કો પોતાના કબજામાં રાખવા બાબત.</p> <p>૧૦૫. ખૂન ન ગણાય એવા સાપરાધ મનુષ્યવધ.</p> <p>૧૦૯. હત્યા કરવાની કોશિશ.</p> <p>૧૧૦. સાપરાધ મનુષ્યવધ કરવાની કોશિશ.</p> <p>૧૧૮(૧). ભયંકર હથિયાર કે સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત.</p> <p>૧૧૭(૨). સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત.</p> <p>૧૧૮(૨). ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત.</p> <p>૧૧૯(૧). બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત.</p> <p>૧૨૩. ગુનો કરવાના ઈરાદાથી ઝેર વગેરેથી વ્યથા કરવા બાબત.</p> <p>૧૧૯(૨). બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત.</p> <p>૧૨૧(૧). રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતાં રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત.</p> <p>૧૨૧(૨). રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતાં રોકવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત.</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>૧૨૭(૭). બળજબરીથી મિલકત કઢાવી લેવા અથવા ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે ગેરકાયદે અટકાયત.</p> <p>૧૪૦(૧). કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે અને ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઈરાદાથી અપહરણ અથવા અપનયન કરવા બાબત.</p> <p>૯૬. સગીર બાલિકા મેળવી આપવા બાબત.</p> <p>૧૪૧. વિદેશમાંથી બાલિકાને આયાત કરવા બાબત.</p> <p>૧૪૨. અપહરણ કરેલી કે અપનયન કરેલી વ્યક્તિને ગેરકાયદે છુપાવી રાખવા કે અટકાયતમાં રાખવા બાબત.</p> <p>૯૭. દસ વર્ષથી ઓછી વયના બાળકના શરીર ઉપરથી કોઈ વસ્તુની ચોરી કરવા માટે તેનું અપહરણ કે અપનયન કરવા બાબત.</p> <p>૩૦૩(૨). ચોરી.</p> <p>૩૦૫(ક). રહેણાંકના ઘર વગેરેમાં ચોરી કરવા બાબત.</p> <p>૩૦૭. ચોરી કરાવવા માટે મૃત્યુ નિપજાવવાની અથવા વ્યથા કરવાની અથવા અવરોધ કરવાની તૈયારી કરીને ચોરી કરવા બાબત.</p> <p>૩૦૮(૨). બળજબરીથી ખંડણી લેવા બાબત.</p> <p>૩૦૮(૩). બળજબરીથી ખંડણી લેવા માટે કોઈ વ્યક્તિને ઈજા કરવાના ભયમાં મૂકવા બાબત.</p> <p>૩૦૮(૫). કોઈ વ્યક્તિને મૃત્યુ અથવા મહાવ્યથાના ભયમાં મૂકીને બળજબરીથી ખંડણી લેવા બાબત.</p> <p>૩૦૮(૪). બળજબરીથી ખંડણી લેવા માટે કોઈ વ્યક્તિને મૃત્યુ અથવા મહાવ્યથાના ભયમાં મૂકવા બાબત.</p> <p>૩૦૯(૪). લૂંટ.</p> <p>૩૦૯(૫). લૂંટ કરવાની કોશિશ.</p> <p>૩૦૯(૬). લૂંટ કરવામાં સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત.</p> <p>૩૧૦(૨). ધાડ.</p> <p>૩૧૧. મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની કોશિશ સાથે લૂંટ અથવા ધાડ.</p> <p>૩૧૨. પ્રાણઘાતક હથિયાર ધારણ કરીને લૂંટ કરવાની અથવા ધાડ પાડવાની કોશિશ કરવા બાબત.</p> <p>૩૧૦(૪). ધાડ પાડવા માટે તૈયારી કરવા બાબત.</p> <p>૩૧૦(૬). ધાડપાડુની ટોળીમાં સામેલ હોવા બાબત.</p> <p>૩૧૩. ચોરીની ટોળીમાં સામેલ હોવા બાબત.</p> <p>૩૧૦(૫). ધાડ પાડવા માટે એકત્રિત થવા બાબત.</p> <p>૩૧૭(૧). બદદાનતથી ચોરીનો માલ લેવા બાબત.</p> <p>૩૧૭(૫). ચોરીનો માલ છુપાવવામાં મદદ કરવા બાબત.</p> <p>૩૩૨(ગ). કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપ-પ્રવેશ.</p> <p>૩૩૩. વ્યથા, હુમલો અથવા ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી કર્યા પછી ગૃહ અપ-પ્રવેશ.</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>૩૩૧(૧). ગુમ ગૃહ અપ-પ્રવેશ અથવા ઘરફોડ.</p> <p>૩૩૧(૩). કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગુમ ગૃહ અપ-પ્રવેશ અથવા ઘરફોડ.</p> <p>૩૩૧(૫). વ્યથા, હુમલો અથવા ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી કર્યા પછી ગુમ ગૃહ અપ-પ્રવેશ અથવા ઘરફોડ.</p> <p>૩૩૧(૨). રાત્રે ગુમ ગૃહ અપ-પ્રવેશ અથવા ઘરફોડ.</p> <p>૩૩૧(૪). કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે રાત્રે ગુમ ગૃહ અપ-પ્રવેશ અથવા ઘરફોડ.</p> <p>૩૩૧(૬). વ્યથા, હુમલો અથવા ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી કર્યા પછી રાત્રે ગુમ ગૃહ અપ-પ્રવેશ અથવા ઘરફોડ.</p> <p>૩૩૧(૭). ગુમ ગૃહ અપ-પ્રવેશ કરતી વખતે અથવા ઘરફોડ કરતી વખતે મહાવ્યથા કરવા બાબત.</p> <p>૩૩૧(૮). રાત્રે ગુમ ગૃહ અપ-પ્રવેશ કરવામાં અથવા રાત્રે ઘરફોડ કરવામાં સંયુક્ત રીતે સામેલ હોય, એવી વ્યક્તિઓ પૈકી કોઈ વ્યક્તિએ મૃત્યુ કે મહાવ્યથા નિપજાવી હોય તો તે તમામ વ્યક્તિઓ શિક્ષાને પાત્ર છે.”</p>
૩૭	૧૯૪૭	૩	ગુજરાત હોમ ગાર્ડ અધિનિયમ, ૧૯૪૭	<p>(ક) કલમ ૬૬માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૬૫માં, પેટા-કલમ (૬)માં, નીચેની પેટા-કલમ મૂકવી:-</p> <p>“(૬) આ કલમ હેઠળ નાખવામાં આવેલો કોઈપણ દંડ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩માં ઠરાવેલી રીત પ્રમાણે કોર્ટ નાખેલા દંડની વસુલાત માટે આ દંડ કોર્ટ નાખ્યો હોય તેમ વસૂલ કરવામાં આવશે.”</p> <p>(ગ) કલમ ૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫-મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૩૮	૧૯૬૧	૨૮	ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ, ૧૯૬૧	<p>(ક) કલમ ૫૪માં, પેટા-કલમ (૪)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૮૩ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫-મા)ની કલમો ૨૨૮ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૮૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫-મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૩૯	૨૦૧૩	૬	ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા અધિનિયમ, ૨૦૧૩	<p>(ક) કલમ ૩૭માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ના અર્થ પ્રમાણે” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૩૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ગ) કલમ ૪૪માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૧૮૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૯, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૪૦	૧૯૫૩	૪૦	ગુજરાત મજૂર કલ્યાણ નિધિ અધિનિયમ, ૧૯૫૩	<p>(ક) કલમ ૧૭માં, પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨૪)માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૨૦માં, પેટા-કલમ ૭૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૪૧	૨૦૨૦	૧૧	ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦	<p>(ક) કલમ ૮માં, પેટા-કલમ (૪)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૧૦માં, “અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩” એ શબ્દો અને આંકડાને બદલે, “અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ગ) કલમ ૧૨માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ઘ) કલમ ૧૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૪૨	૧૯૪૨	૨૮	ગુજરાત જમીન સુધારણા યોજના અધિનિયમ, ૧૯૪૨	કલમ ૨૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમના અર્થ મુજબ” એ શબ્દોને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.



અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૪૩	૧૯૪૮	૩૩	ગુજરાત જમીન માંગણી અધિનિયમ, ૧૯૪૮	(ક) કલમ ૧૨માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૭૬ અને ૧૭૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૧૧ અને ૨૧૨ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૧૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૪૪	૧૯૭૯	૫	ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૯૭૯	(ક) કલમ ૩માં, ખંડ (૨૭)માં, “ભારતના પુરાવા અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૭૬થી ઠરાવેલી રીતે” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૭-મા)ની કલમ ૭૫-થી ઠરાવેલી રીતે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૨૬માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમના પ્રકરણ-૭ની જોગવાઈઓ હેઠળ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ના પ્રકરણ-૭ની જોગવાઈઓ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ગ) કલમ ૧૪૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમના અર્થ મુજબ” એ શબ્દોને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ઘ) કલમ ૧૯૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમો ૧૯૩, ૨૧૯ તથા ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૯, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ચ) અનુસૂચિ ૬-માં, પરિચ્છેદ ૨-માં, પેટા-પરિચ્છેદ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ” એ શબ્દોને બદલે, “ભારતીય નાગરિક સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૬મો)” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૪૫	૨૦૦૦	૪	ગુજરાત લિફ્ટ અને સરકતી સીડી અધિનિયમ, ૨૦૦૦	(ક) કલમ ૧૪માં, પેટા-કલમ (૫)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૧૭૬ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૧૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૪૬	૧૯૮૦	૨૫	ગુજરાત પશુધન સુધારણા અધિનિયમ, ૧૯૮૦	(ક) કલમ ૧૮માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૭૩ હેઠળના કોઈ પોલીસ અધિકારી” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૯૩ હેઠળના કોઈ પોલીસ અધિકારી” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૪૭	૧૯૮૬	૩૧	ગુજરાત લોકાયુક્ત અધિનિયમ, ૧૯૮૬	(ક) કલમ ૨માં, ખંડ (૮)માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧માં જે અર્થ કરવામાં આવ્યો છે તે જ થશે.” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)માં જે અર્થ કરવામાં આવ્યો છે તે જ થશે.” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ખ) કલમ ૧૧માં,-</p> <p>(૧) પેટા-કલમ (૩)માં, "ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૧૭૬ અને કલમ ૧૭૭ના અર્થ મુજબ" એ શબ્દો અને આંકડાને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૧૧ અને ૨૧૨ના અર્થ મુજબ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૨) પેટા-કલમ (૪)માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૦૦ની જોગવાઈઓ લાગુ પડતી હોય તેટલા પૂરતી તેને અધીન રહીને" એ શબ્દો અને આંકડાને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૦૩ની જોગવાઈઓ લાગુ પડતી હોય તેટલા પૂરતી તેને અધીન રહીને" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૩) પેટા-કલમ (૫)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી:-</p> <p>"(૫) લોકાયુક્ત દીવાની કોર્ટ ગણાશે અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૧૦, ૨૧૩, ૨૧૪ અથવા કલમ ૨૧૫માં વર્ણવ્યા પ્રમાણેનો કોઈ ગુનો, લોકાયુક્તના અભિપ્રાય મુજબ અથવા તેમની હાજરીમાં થયો હોય, ત્યારે લોકાયુક્ત, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ઠરાવ્યા પ્રમાણે ગુનો બનતી હકીકતો અને આરોપીનું નિવેદન નોંધ્યા પછી, તે કેસ, તેનો ઈન્સાફ ચલાવવાની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટને મોકલી શકશે અને તે મેજિસ્ટ્રેટ જાણે તે કેસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૩૮૫ હેઠળ મોકલવામાં આવ્યો હોય તેમ, આરોપી વિરુદ્ધ ફરિયાદની સુનાવણી આગળ ચલાવવી જોઈશે."</p> <p>(૪) પેટા-કલમ (૬)માં, "ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૧૯૩ અને ૨૨૮ના અર્થ મુજબ" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૭મા)ની કલમ ૨૨૯ અને ૨૬૭ના અર્થ મુજબ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ગ) કલમ ૧૬માં,</p> <p>(૧) પેટા-કલમ (૧)માં, "ભારતનો પુરાવા અધિનિયમ, ૧૯૭૨માં ગમે તે મજકૂર હોય તે છતાં" એ શબ્દો અને આંકડાને બદલે, "ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૭મા)માં ગમે તે મજકૂર હોય તે છતાં" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૨) પેટા-કલમ (૨)માં, "ભારતીય ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા) હેઠળ ખોટા પુરાવા" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૫મા) હેઠળ ખોટા પુરાવા" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ઘ) કલમ ૧૭માં, પેટા-કલમ (૩)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી:-</p> <p>"(૩) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા) ની કલમ ૨૨૨ની જોગવાઈઓ, તે સદરહુ કલમ ૨૨૨ની પેટા-કલમ (૨)માં ઉલ્લેખિત ગુનાના સંબંધમાં લાગુ પડે તેમ પેટા-કલમ (૧) અથવા પેટા-કલમ (૨) હેઠળના ગુનાના સંબંધમાં, લોકાયુક્તની પૂર્વ-મંજૂરી સિવાય સરકારી વકીલ દ્વારા આવા ગુનાના સંબંધમાં કોઈ ફરિયાદ કરવામાં આવશે નહીં એવા ફેરફારને અધીન રહીને લાગુ પડશે."</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૪૮	૧૯૫૮	૮૨	ગુજરાત લોટરી (નિયંત્રણ અને વેરો) અને ઈનામ સ્પર્ધાઓ (વેરો) અધિનિયમ, ૧૯૫૮	<p>(ક) કલમ ૧૯માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના પમા)ની જોગવાઈઓ સાથે" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૬મો)ની જોગવાઈઓ સાથે" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૨૧માં, પેટા-કલમ (૨)માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના પમા)થી મળેલ" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)થી મળેલ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ગ) કલમ ૨૭માં, "ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ઘ) કલમ ૩૩માં, "ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૮૪-ક જોગવાઈઓ" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૮૭ની જોગવાઈઓ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૪૯	૧૯૮૧	૩૦	ગુજરાત મેરિટાઈમ બોર્ડ અધિનિયમ, ૧૯૮૧	<p>કલમ ૯ને બદલે, નીચેની કલમ મૂકવી:-</p> <p>"૯. આ અધિનિયમ હેઠળ બોર્ડ દ્વારા નિયુક્ત દરેક વ્યક્તિ, ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૧૯, ૨૨૦ અને ૩૧૬(પ)ના હેતુ માટે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (૧૯૮૮ના ૪૯મા)ના હેતુઓ માટે, ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ જાહેર સેવક તરીકે ગણવામાં આવશે."</p> <p>(ખ) કલમ ૧૦૧માં, "ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૧૬૮ હેઠળનો ગુનો" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૦૨ હેઠળનો ગુનો" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૫૦	૨૦૧૧	૧૪	ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ, ૨૦૧૧	<p>(ક) કલમ ૧૦માં, પેટા-કલમ (૧)માં, ખંડ (ઘ)માં, પેટા-ખંડ (૨)માં, "ભારતનો ફોજદારી અધિનિયમના પ્રકરણ ૧૭ અથવા પ્રકરણ ૧૭ની કલમ ૪૬૫ અથવા ૪૭૭-ક હેઠળના ગુના" એ શબ્દો, આંકડા અને અક્ષરને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના પ્રકરણ ૧૭ અથવા કલમ ૩૩૬(૨) અથવા ૩૪૪ હેઠળના ગુના" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૧૯માં, પેટા-કલમ (૩)માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૩ના ૨૪)ની જોગવાઈઓ સાથે" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ સાથે" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ગ) કલમ ૪૭માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય તે છતાં" એ શબ્દો અને આંકડાને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તે છતાં" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ઘ) કલમ ૫૧માં, "ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ" એ શબ્દો અને આંકડાને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૫૧	૧૯૫૮	૬૭	ગુજરાત મોટર વાહન (ઉતાડ-વેરા) અધિનિયમ, ૧૯૫૮	<p>(ક) કલમ ૧૪માં, પેટા-કલમ (૨)માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની જોગવાઈઓ અનુસાર" એ શબ્દો અને આંકડાને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ અનુસાર" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૧૮માં, "ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૫૨	૨૦૧૭	૧૬	ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૧૭	(ક) કલમ ૬૨-માં, "ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ" એ શબ્દો અને આંકડાને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૫૩	૧૯૫૧	૨૨	ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧	<p>(ક) કલમ ૨માં, ખંડ (પ)માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ના હેતુઓ માટે" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૬મા)ના હેતુઓ માટે" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૩૦માં, પેટા-કલમ (૨)માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ની જોગવાઈઓ" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ગ) કલમ ૩૨માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ની કલમ ૧૪૪ હેઠળ" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૬૩ હેઠળ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ઘ) કલમ ૩૨માં, હાંસિયાની નોંધમાં, "સન ૧૯૮૮ના ૫મા અધિનિયમની કલમ ૧૪૪ હેઠળ રાજ્ય સરકાર હુકમ કરી શકશે" એ શબ્દો અને આંકડાને બદલે, "ઉપદ્રવ (ત્રાસ) અથવા જોખમની આશંકાના તાકીદના કેસોમાં હુકમ બહાર પાડવાની સત્તા" એ શબ્દો મૂકવા.</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ચ) કલમ ૪૪માં, પેટા-કલમ (૪)માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ ના પમા)ની કલમ ૩૮૬ હેઠળ" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૪૬૧ હેઠળ" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(છ) કલમ ૫૬માં, "ભારતનો ફોજદારી અધિનિયમના પ્રકરણ ૧૨, ૧૬ અથવા ૧૭ હેઠળનો શિક્ષાપાત્ર ગુનો" એ શબ્દો અને આંકડાને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના પ્રકરણ ૬, ૧૦ અથવા ૧૭ હેઠળનો શિક્ષાપાત્ર ગુનો" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(જ) કલમ ૫૭માં, -</p> <p>(૧) ખંડ (ક)માં, "ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા)ના પ્રકરણ ૧૨, ૧૬ અથવા ૧૭ હેઠળનો ગુનો" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના પ્રકરણ ૬, ૧૦ અથવા ૧૭ હેઠળનો ગુનો" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(૨) સ્પષ્ટીકરણમાં, પેટા-ખંડ (૨)-માં, "ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા)ના કોઈપણ પ્રકરણો હેઠળ આવતો ગુનો" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના કોઈપણ પ્રકરણ હેઠળ આવતો ગુનો" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ઝ) કલમ ૬૫માં, પેટા-કલમ (૨)માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના પમા)ની કલમ ૫૨૩ અને ૫૨૫ અનુસાર" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૫૦૩ અને ૫૦૫ અનુસાર" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ટ) કલમ ૮૫માં, પેટા-કલમ (૧)માં, "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના પમા)ની કલમ ૧૫૩માં ગમે તે મજકૂર હોય તે છતાં" એ શબ્દો, આંકડા અને કૌંસ કમી કરવા.</p> <p>(ઠ) કલમ ૮૬માં,</p> <p>(૧) પેટા-કલમ (૧)માં, -</p> <p>(૧) "ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના પમા)ની કલમો ૧૨૮, ૧૩૦, ૧૬૭ની પેટા-કલમ (૨) અને કલમ ૧૭૩માં ગમે તે મજકૂર હોય તે છતાં" એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૪૮, ૧૪૯, કલમ ૧૮૭ની પેટા-કલમ (૨)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં" એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(૨) ખંડ (૧)માં, “અધિનિયમની કલમ ૧૨૯ અને ૧૩૦ હેઠળ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૪૮ અને ૧૪૯ હેઠળ” એ શબ્દો અને આંકડા મૂકવા.</p> <p>(૩) ખંડ (૩)માં, “અધિનિયમની કલમ ૧૭૩ હેઠળ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૩ હેઠળ” એ શબ્દો અને આંકડા મૂકવા.</p> <p>(૨) પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૯૮ (સન ૧૮૯૮ના ૫મા)ની કલમ ૬૨માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૫૯માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા.</p> <p>(૩) પેટા-કલમ (૩)માં,</p> <p>(૧) “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૯૮ (સન ૧૮૯૮ના ૫મા)ની કલમ ૧૨૭ અને ૧૨૮” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૪૮ અને ૧૪૯” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા.</p> <p>(૨) ખંડ (ક)માં, “કલમ ૧૨૭માં” એ શબ્દો અને આંકડાને બદલે, “કલમ ૧૪૮માં” એ શબ્દો અને આંકડા મૂકવા.</p> <p>(૩) ખંડ (ખ)માં, “કલમ ૧૨૮માં” એ શબ્દો અને આંકડાને બદલે, “કલમ ૧૪૯માં” એ શબ્દો અને આંકડા મૂકવા.</p> <p>(૩) કલમ ૧૨૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૪૧૦માં જણાવેલો કોઈ ગુનો કર્યાથી અથવા સદરહુ અધિનિયમની કલમો ૪૧૭, ૪૧૮, ૪૧૯ અથવા ૪૨૦ની રૂએ કોઈ શિક્ષાપાત્ર ગુનો કર્યાથી કોઈ મિલકત તબદીલ થયાની લેખિત અથવા છાપેલી ખબર પોલીસ અધિકારી તરફથી મળી હોય અને તેના કબજામાં તે ખબરમાં જણાવેલા પ્રકારની મિલકત મળશે અથવા તે મળ્યા પછી તેના કબજામાં તે આવશે અથવા તેને તે મિલકત વેચાતી રાખવાની, રાખવાની, ગીરો રાખવાની, અદલ-બદલ કરવાની, અથવા હવાલામાં રાખવાની, તેમાં ફેરફાર કરવાની અથવા બીજા કોઈ પ્રકારની માંગણી કરવામાં આવશે,” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૩૧૭ (૪)માં જણાવેલો કોઈ ગુના કર્યાથી અથવા સંહિતાની કલમ ૩૧૮(૨), ૩૧૮(૩), ૩૧૯(૨) અથવા ૩૧૮(૪) હેઠળ કોઈ શિક્ષાપાત્ર ગુનો કર્યાથી કોઈ મિલકત તબદીલ થયાની લેખિત અથવા છાપેલી ખબર પોલીસ અધિકારી તરફથી મળી હોય અને તેના કબજામાં તે ખબરમાં જણાવેલા</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>પ્રકારની મિલકત મળશે અથવા તે મળ્યા પછી તેના કબજામાં તે આવશે અથવા તેને તે મિલકત વેચાતી રાખવાની, રાખવાની, ગીરો રાખવાની, અદલ-બદલ કરવાની, અથવા હવાલામાં રાખવાની, તેમાં ફેરફાર કરવાની અથવા બીજા કોઈ પ્રકારની માંગણી કરવામાં આવશે,” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ઢ) કલમ ૧૨૭માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૪૧૦ના અર્થ પ્રમાણે ચોરીની મિલકત છે અથવા જેને માટે સદરહુ કાયદાની કલમ ૪૧૭, ૪૧૮, ૪૧૯ અથવા ૪૨૯ મુજબ શિક્ષા પાત્ર કોઈ ગુનો” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫-મા)ની કલમ ૩૧૭(૧)ના અર્થ મુજબ અથવા જેને માટે સદરહુ સંહિતા (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૩૧૮(૨), ૩૧૮(૩), ૩૧૯(૨) અથવા ૩૧૮(૪) હેઠળનો શિક્ષાપાત્ર કોઈ ગુનો” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ત) કલમ ૧૩૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૪૧૫ના અર્થ પ્રમાણે ઠગાઈ કરી ગણાશે અને તે, તે પ્રમાણે શિક્ષાને પાત્ર થશે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૩૧૮ (૧)ના અર્થ મુજબ ઠગાઈ કરી ગણાશે અને તે, તે પ્રમાણે શિક્ષાને પાત્ર થશે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૫૪	૧૯૮૫	૧૬	ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ, ૧૯૮૫	<p>(ક) કલમ ૨-માં,</p> <p>(૧) ખંડ (ગ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ના પ્રકરણ ૮ અથવા પ્રકરણ ૧૬ (કલમ ૩૫૪, ૩૫૪ક, ૩૫૪ગ, ૩૫૪ઘ, ૩૭૬, ૩૭૬ક, ૩૭૬ખ, ૩૭૬ગ અથવા ૩૭૭ સિવાય) અથવા પ્રકરણ ૧૭ અથવા પ્રકરણ ૨૨ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના પ્રકરણ ૧૧ અથવા પ્રકરણ ૬ (કલમ ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૬૪, ૬૬, ૬૭, ૬૮ સિવાય) અથવા પ્રકરણ ૧૭ અથવા પ્રકરણ ૧૯ હેઠળ શિક્ષાપાત્ર ગુના” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(૨) ખંડ (ઝક)માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૩૫૪, ૩૫૪ક, ૩૫૪ખ, ૩૫૪ગ, ૩૫૪ઘ, ૩૭૬, ૩૭૬-ક, ૩૭૬ખ, ૩૭૬ગ અથવા ૩૭૭ હેઠળ શિક્ષાપાત્ર” એ શબ્દો આંકડા અને અક્ષરોને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૭૪, ૭૫, ૭૭, ૭૮, ૬૪, ૬૬, ૬૭, ૬૮, ૭૦(૧) હેઠળ શિક્ષાપાત્ર” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૪માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(સન ૧૯૭૪નો ૨-જા) હેઠળ ધરપકડ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા) હેઠળ ધરપકડ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ગ) કલમ ૮માં,</p> <p>(૧) પેટા-કલમ (૧)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી:-</p> <p>“(૧) રાજ્ય સરકાર અથવા કોઈ અધિકૃત અધિકારીને એમ માનવાને કારણ હોય કે કોઈ વ્યક્તિ જેના સંબંધમાં અટકાયતનો હુકમ કરવામાં આવ્યો છે તે ફરાર થઈ ગઈ છે, અથવા પોતે એ રીતે છુપાતી ફરી રહી છે જેથી હુકમની અમલબજવણી કરી શકાય એમ નથી, તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૮૪ થી ૮૮ (બંને સહિત)ની જોગવાઈઓ, આ પેટા-કલમમાં ઉલ્લેખિત ફેરફારોને અધીન આવી વ્યક્તિ અને તેની મિલકતના સંબંધમાં લાગુ પડશે અને એવી વ્યક્તિ સામાન્ય રીતે જ્યાં રહેતી હોય એવા કોઈપણ સ્થળને ધ્યાનમાં લીધા વિના તેની સામે કરવામાં આવેલ અટકાયતનો હુકમ સક્ષમ ન્યાયાલય દ્વારા બહાર પાડવામાં આવેલ વોરંટ છે એમ ગણાશે, રાજ્ય સરકારે અટકાયત હુકમ કર્યો હોય ત્યારે આ અર્થે રાજ્ય સરકાર દ્વારા અધિકૃત જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનરના દરજ્જાથી નીચેના દરજ્જાના ન હોય તે અધિકારી અથવા અધિકૃત અધિકારીએ અટકાયતનો હુકમ કર્યો હોય ત્યારે અધિકૃત અધિકારી, તેની સામાન્ય હકૂમત ગમે તે હોય તો પણ, એવી વ્યક્તિ માટે અને રાજ્યના કોઈપણ ભાગમાં આવેલી તેની મિલકતની જમ્ની અને વેચાણ માટે જાહેરાત બહાર પાડવા માટે અને સદરહુ સંહિતાની કલમો ૮૪, ૮૫, ૮૭ અને ૮૮ હેઠળ અન્ય કોઈ પગલાં લેવા માટે સદરહુ કલમો હેઠળ સત્તા ધરાવતી કોર્ટની તમામ સત્તાઓ વાપરવા માટે અધિકૃત છે એમ ગણાશે. જમ થયેલી મિલકત પાછી મેળવવા માટેની અરજી નામંજૂર કરતા એવા કોઈ અધિકારીએ કરેલા કોઈ હુકમ સામે અપીલ, સદરહુ વ્યક્તિ સામાન્ય રીતે જ્યાં રહેતી હોય તે સ્થળે, હકૂમત ધરાવતી સેશન્સ કોર્ટને, સદરહુ સંહિતાની કલમ ૮૮માં કરેલી જોગવાઈમાં ઠરાવ્યા પ્રમાણે થઈ શકશે.”</p> <p>(૨) પેટા-કલમ (૨)માં, ખંડ (ગ)માં, “સદરહુ અધિનિયમમાં સમાવિષ્ટ” એ શબ્દોને બદલે, “સદરહુ સંહિતામાં સમાવિષ્ટ” એ શબ્દો મૂકવા.</p>
૫૫	૧૯૬૦	૧૦	ગુજરાત બિશ્વા નિવારણ અધિનિયમ, ૧૯૫૯	<p>(ક) કલમ ૪માં, પેટા-કલમ (૩)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ની કલમ ૬૧ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૫૮ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૮માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ની કલમ ૪૮૮ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૪૪ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ગ) કલમ ૮માં, પેટા-કલમ (૩)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ની કલમ ૬૧ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૫૮ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ઘ) કલમ ૩૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>



અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ચ) કલમ ૩૩માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના પમા)ના પ્રકરણ ૪૨ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ના પ્રકરણ ૩૫ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(છ) કલમ ૩૪માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના પમા) હેઠળ અપીલ અને ફેરતપાસના હેતુઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૬મા હેઠળ અપીલ અને ફેરતપાસના હેતુઓ માટે)” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૫૬	૧૯૮૮	૪	ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ, ૧૮૮૭	(ક) કલમ ૪માં, પેટા-કલમ (૨)માં, “અથવા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૩ના ૨૧)ની કલમ ૩૬૦ની પેટા-કલમો (૧), (૪), (૫) અને (૬)માં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩(સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૪૦૧ની પેટા-કલમો (૧), (૪), (૫) અને (૬)માં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૫૭	૧૯૪૯	૨૫	ગુજરાત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯	<p>(ક) કલમ ૨માં,</p> <p>(૧) ખંડ ૨૮માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૩ના ૨૧)માં આપેલી વ્યાખ્યા મુજબનું પોલીસ સ્ટેશન” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં આપેલી વ્યાખ્યા મુજબનું પોલીસ સ્ટેશન” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(૨) ખંડ ૩૩માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(સન ૧૯૭૩ના ૨૧)ના હેતુઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ના હેતુઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(૩) ખંડ ૫૨માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૩ના ૨૧)નો કોઈપણ સંદર્ભ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)નો કોઈપણ સંદર્ભ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p> <p>(ખ) કલમ ૫૪માં, પેટા-કલમ (૧)માં, ખંડ (ધ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૪૮૨ થી ૪૮૯ (બન્ને સહિત) હેઠળનો શિક્ષાપાત્ર ગુનો” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૩૪૫(૩), ૩૪૭(૧), ૩૪૭(૨), ૩૪૮, ૩૪૯, ૩૫૦(૧), ૩૫૦(૨) અને ૩૪૬ હેઠળનો શિક્ષાપાત્ર ગુનો” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ગ) કલમ ૭૮માં,-</p> <p>(૧) ખંડ (ક)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૭૨ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે,</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>“ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૭૪ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૨) ખંડ (ગ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૪૮૨ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૩૪૫(૩) હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૩) ખંડ (ઘ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૪૮૬ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૩૪૯ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ઘ) કલમ ૮૧માં, પેટા-કલમ (૨)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી;</p> <p>“(૨) ખત (બોન્ડ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ હેઠળ જોગવાઈ કરવામાં આવે તેમ રહેશે અને સદરહુ સંહિતાની જોગવાઈઓ, સદરહુ સંહિતાની કલમ ૧૨૫ હેઠળ અમલ કરવાના આદેશથી શાંતી જાળવવા માટેનો ખત હોય તેમ, તેવા ખત સાથે જોડાયેલા તમામને લાગુ પાડી શકાય તેટલે સુધી, લાગુ પડશે.”</p> <p>(ચ) કલમ ૮૩માં, પેટા-કલમ (૨)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી;</p> <p>“(૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ લાગુ પાડી શકાય તેટલે સુધી, સદરહુ સંહિતાની કલમ ૧૨૯ હેઠળ અમલ કરવાનું ફરમાવવામાં આવ્યું હોય તેમ, તેમાં ઉલ્લેખેલ ખત, જાણે કે ખત હોય તે રીતે, પેટા-કલમ (૧) હેઠળની કોઈપણ કાર્યવાહિને લાગુ પડશે.</p> <p>(છ) કલમ ૧૦૨માં, પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ (સન ૧૯૭૪ના ૨જા) હેઠળ ઝડતી વોરંટ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા) હેઠળ ઝડતી વોરંટ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(જ) કલમ ૧૦૪ક-માં, “રાજ્ય અથવા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની કલમ ૩૦૬માં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “રાજ્ય અથવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૪૦૧માં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ઝ) કલમ ૧૧૫ક-માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ટ) કલમ ૧૧૭માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ઢ) કલમ ૧૨૮માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ડ) કલમ ૧૨૮માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)થી મળેલી સત્તા” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)થી મળેલી સત્તા” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ઢ) કલમ ૧૨૮ક-માં, પેટા-કલમ (૫)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૧૮૬ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૨૧ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ત) કલમ ૧૩૧માં,-</p> <p>(૧) પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૨) પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>
૫૮	૧૯૯૧	૧૨	ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત અધિનિયમ, ૧૯૯૧.	(ક) કલમ ૬-ચ-માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય તેમ છતા” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતા” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;
૫૯	૨૦૦૪	૧	ગુજરાત (નાણાકીય સંસ્થાઓમાં) થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ, ૨૦૦૩.	(ક) કલમ ૧૭માં,-
				(૧) પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)માં ઠરાવેલી” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ઠરાવેલી” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(૨) પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની કલમ ૪૩૮ સિવાયની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૪૮૨ સિવાયની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;
૬૦	૧૯૪૯	૫૯	ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯.	<p>(ક) કલમ ૬૫માં, પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૯૮ (સન ૧૯૯૮ના ૫મા)ના પ્રકરણ ૩૪ હેઠળનો હુકમ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ના (પ્રકરણ) ૨૭ હેઠળનો હુકમ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૩૦૫માં, પેટા-કલમ (૩)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૭૫ અને ૧૭૬નો અર્થ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૧૦ અને ૨૧૧નો અર્થ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ગ) કલમ ૩૨૫માં, પેટા-કલમ (૧)માં, ખંડ (ઘ)માંના શબ્દોને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૯૫ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ઘ) કલમ ૩૯૩માં,</p> <p>(૧) હાંસિયાની નોંધમાં, “ફોજદારી અધિનિયમ” એ શબ્દોને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩” એ શબ્દો અને આંકડા મૂકવા;</p> <p>(૨) પેટા-કલમ (૧)માં, “જે કલમો હેઠળ તેવી વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તે સદરહુ અધિનિયમની કલમો તરીકે સદરહુ કોષ્ટકના બીજા કોલમમાં અનુક્રમે નિર્દિષ્ટ કરેલી ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ હેઠળની, એટલે કે આ અધિનિયમની કલમો, ભારતનો ફોજદારી અધિનિયમની કલમો જે હેઠળ ગુનેગાર શિક્ષાને પાત્ર હોય તેવી કલમ ૧૯૪(૨), ૩૧૧, ખંડો (ક), (ખ), (ગ) અને (ઘ), ૩૧૨, ૨૭૭, ૩૧૯, ૧૮૮, ૪૭૭, ૧૭૭” એ શબ્દોને બદલે, “જે કલમો હેઠળ તેવી વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તે સદરહુ અધિનિયમની કલમો તરીકે સદરહુ કોષ્ટકના બીજા કોલમમાં અનુક્રમે નિર્દિષ્ટ કરેલી, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ હેઠળની, એટલે કે આ અધિનિયમની કલમો, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમો જે હેઠળ ગુનેગાર શિક્ષાને પાત્ર હોય તેવી કલમ ૨૨૯ (૨), ૮૮, ૨૭૯, ૧૧૪, ૩૪૩, ૨૧૨” એ શબ્દો મૂકવા;</p> <p>(૩) પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૧૭૬ અથવા કલમ ૧૭૭ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૧૧ અથવા ૨૧૨ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(૪) પેટા-કલમ (૩)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૧૭૭ હેઠળ શિક્ષાને પાત્ર હોય” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૧૨ હેઠળ શિક્ષાને પાત્ર હોય” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;</p> <p>(૫) પેટા-કલમ (૪)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૧૭૬ અથવા કલમ ૧૭૭ હેઠળ શિક્ષાને પાત્ર હોય” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૧૧ અથવા કલમ ૨૧૨ હેઠળ શિક્ષાને પાત્ર હોય” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;</p> <p>(ચ) કલમ ૪૨૨માં, પેટા-કલમ (૧)માં, પરંતુકમાં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ની કલમ ૧૭ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૩ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;</p> <p>(છ) કલમ ૪૨૫-માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૭૩ની જોગવાઈઓ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૭૫ની જોગવાઈઓ” એ શબ્દો અને આંકડા મૂકવા;</p> <p>(જ) કલમ ૪૨૭માં,</p> <p>(૧) પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના ૫મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતા” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતા” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;</p> <p>(૨) પેટા-કલમ (૩)માં, “સદરહુ અધિનિયમની કલમ ૨૦૦-માં ગમે તે મજકૂર હોય” એ શબ્દોને બદલે, સદરહુ સંહિતાની કલમ ૨૨૩-માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો મૂકવા;</p> <p>(ઝ) કલમ ૪૩૭માં,-</p> <p>(૧) હાંસિયાની નોંધમાં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ” એ શબ્દોને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા” એ શબ્દો મૂકવા;</p> <p>(૨) “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના ૫મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;</p> <p>(ટ) કલમ ૪૮૨-માં,</p> <p>(૧) પેટા-કલમ (૧)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌસને</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૨) પેટા-કલમ કમી કરવી.</p> <p>(ઠ) અનુસૂચિ ઘ-માં, પરિચ્છેદ (૩)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૧૮૩ અને ૨૨૮-ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮ અને ૨૬૭-ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>
૬૧	૨૦૨૩	૨	ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ, ૨૦૨૩	<p>(ક) કલમ ૧૨માં, પેટા-કલમો (૧) થી (૪)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો જ્યાં જ્યાં આવતા હોય ત્યાં એ શબ્દોને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ અનુસાર” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૧૪માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ઠરાવેલી કાર્યરીતિ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ઠરાવેલી કાર્યરીતિ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ગ) કલમ ૧૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>
૬૨	૧૯૪૮	૫૭	ગુજરાત ભાડાં, હોટેલ અને નિવાસગૃહ દર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭	<p>(ક) કલમ ૪૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૨૦૨૩ના ૪૫મા)ની ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૪૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૧૮૩ અને ૨૨૮-ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮ અને ૨૬૭ના હેતુઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ગ) કલમ ૪૭માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫-મા)ની કલમ ૩૨-માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૩(૧)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>
૬૩	૧૯૭૬	૩૫	ગુજરાત ગ્રામ દેવાદાર રાહત અધિનિયમ, ૧૯૭૬.	<p>(ક) કલમ ૨૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૧૮૩, ૨૧૮ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(ખ) કલમ ૨૧માં, પેટા-કલમ (૨)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી;  “(૨) “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની પેટા-કલમ (૧)માં જોગવાઈ કરી હોય તે સિવાયની અન્ય જોગવાઈઓ, સદરહુ સંહિતાની જોગવાઈઓ હેઠળ કરેલી કોઈપણ ઝડતી અથવા જમીને લાગુ પડે છે તેમ, લાગુ પાડી શકાય તેટલે સુધી, તેવી ઝડતી અથવા જમીને લાગુ પડશે.
૬૪	૧૯૭૨	૨૨	ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ, ૧૯૭૨	(ક) પેટા-કલમ (૪૭)માં, પેટા-કલમ (૪)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૭૫-માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫-મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;
૬૫	૨૦૧૮	૧૮	ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ (જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા) બાબત અધિનિયમ, ૨૦૧૮	(ક) કલમ ૧૩ને બદલે, નીચેની કલમ મૂકવી:-  “૧૩. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતા,  (ક) કલમ ૧૨ હેઠળના શિક્ષાપાત્ર ગુના, પોલીસ અધિકારના અને બિન-જામીનપાત્ર ગણાશે;  (ખ) આ અધિનિયમ હેઠળના શિક્ષાપાત્ર દરેક ગુના અંગે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ઠરાવેલા સમન્સપાત્ર કેસની કાર્યરીતિને અનુસરીને પ્રથમ વર્ગના કોઈ મેજિસ્ટ્રેટ દ્વારા અદાલતી કાર્યવાહી કરવી જોઈશે.”
૬૬	૨૦૧૮	૪	ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, ૨૦૧૮.	(ક) કલમ ૨૫માં,-  (૧) પેટા-કલમ (૪)માં, ભારતનો ફોજદારી અધિનિયમની કલમો ૧૭૫ અને ૧૭૬ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૧૦ અને ૨૧૧-ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (૨) પેટા-કલમ (૫)માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨(૨૮)-ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૩૩માં,-  (૧) પેટા-કલમ (૨)માં, “મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ” એ શબ્દોને બદલે, “જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ” એ શબ્દો મૂકવા;

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(૨) પેટા-કલમ (૩)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી;  “(૩) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતા, પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આ અધિનિયમ હેઠળ ઠરાવેલો દંડ લાદી શકશે અને શિક્ષા કરી શકશે.”  (ગ) કલમ ૩૪માં, પેટા-કલમ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય તેમ છતા” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતા” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;
૬૭	૨૦૦૪	૧૧	ગુજરાત ખાસ આર્થિક ઝોન અધિનિયમ, ૨૦૦૪.	(ક) કલમ ૨૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;
૬૮	૧૯૫૮	૬૦	ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮.	(ક) કલમ ૬૨-ખ-માં,-  (૧) પેટા-કલમ (૧)માં, “ભારતનો પુરાવા અધિનિયમ, ૧૯૭૨ (સન ૧૯૭૨ના ૧લા)માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૭મા) માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (૨) પેટા-કલમ (૩)માં, ખંડ (ક)માં, ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા) હેઠળની ફોજદારી કાર્યવાહી” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા) હેઠળની ફોજદારી કાર્યવાહી” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;
૬૯	૨૦૦૩	૨૦	ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૩.	(ક) કલમ ૩૯માં, પેટા-કલમ (૨૦)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૩ના ૨૪મા)ની કલમ ૨૦૦-માં ગમે તે મજકૂર હોય તેમ છતા” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૨૩માં ગમે તે મજકૂર હોય તેમ છતા” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૪૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;
૭૦	૧૯૫૮	૯૯	ગુજરાત ગણોત્તર વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ, ૧૯૫૮	(ક) કલમ ૮માં, પેટા-કલમ (૪)માં, “ભારતનો પુરાવા અધિનિયમ, ૧૯૭૨ (સન ૧૯૭૨ના ૧લા)ની કલમ ૯૨માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૭મા)ની કલમ ૯૫માં ગમે તે મજકૂર હોય” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૮૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮) હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;



અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(ગ) કલમ ૮૭માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના જપમા)ની કલમ ૨૧ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા)ની કલમ ૨(૨૮) હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા; (ઘ) કલમ ૧૧૫-માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના જપમા)ની કલમો ૧૮૩, ૨૧૮ અને ૨૨૮” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા)ની કલમો ૨૨૮, ૨૫૭ અને ૨૬૭” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;
૭૧	૧૯૪૮	૬૭	ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮	(ક) કલમ ૬૨ માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના જપમા)ની કલમ ૨૧ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા)ની કલમ ૨(૨૮) હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા. (ખ) કલમ ૮૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના જપમા)ની કલમો ૧૮૩, ૨૧૮ અને ૨૨૮” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા)ની કલમ ૨૨૮, ૨૫૭ અને ૨૬૭” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૭૨	૨૦૦૭	૧૮	ગુજરાત પાણી વપરાશકાર સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૭	(ક) કલમ ૪૧માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના જપમા)ના અર્થ મુજબ દુર્વ્યય” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા)ના અર્થ મુજબ દુર્વ્યય” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૭૩	૨૦૦૮	૯	કામધેનુ યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૮	(ક) કલમ ૫૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના જપમા)ના અર્થ મુજબ”, એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા) ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૭૪	૧૯૦૬	૨	મામલતદાર કોર્ટ અધિનિયમ, ૧૯૦૬	(ક) કલમ ૨૧માં, પેટા-કલમ (૪)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના જપમા)ની કલમ ૧૮૩ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા)ની કલમ ૨૨૩ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા. (ખ) કલમ ૨૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના જપમા)ની કલમ ૧૮૮ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા)ની કલમ ૨૨૮ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા. (ગ) કલમ ૨૬માં, ખંડ (ખ)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના પમા)ના પ્રકરણ ૧૨ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા)ના પ્રકરણ ૧૧ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૭૫	૨૦૦૭	૧૪	પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ૨૦૦૭	(ક) કલમ ૩૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના જપમા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૭૬	૧૯૫૨	૩	સૌરાષ્ટ્ર એસ્ટેટ સંપાદન અધિનિયમ, ૧૯૫૨	(ક) કલમ ૧૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૯, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૭૭	૧૯૪૯	૪૧	સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, ૧૯૪૯	(ક) કલમ ૫૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ હેઠળ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮) હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૭૮	૨૦૨૦	૧૬	અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ નિયમન અધિનિયમ, ૨૦૨૦	(ક) કલમ ૫૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૭૯	૧૯૫૦	૨૪	ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦	(ક) કલમ ૭૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૯, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.  (ખ) કલમ ૭૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૦	૨૦૦૫	૨૪	સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૫	(ક) કલમ ૩૧માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૧	૨૦૦૯	૧૫	બાળ વિશ્વવિદ્યાલય અધિનિયમ, ૨૦૦૯	(ક) કલમ ૪૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૨	૨૦૦૫	૧૯	ગણપત યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૫	(ક) કલમ ૩૧માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૩	૨૦૧૧	૧૦	ગુજરાત શરીરરચના અધિનિયમ, ૨૦૧૧	(ક) કલમ ૪માં, પેટા-કલમ (૩)માં, ખંડ (૧)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૭૪માં ઉલ્લેખેલા” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪માં ઉલ્લેખેલા” એ શબ્દો અને આંકડા મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(ખ) કલમ ૧૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૪	૨૦૨૧	૮	ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૨૧	(ક) કલમ ૪૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪પમા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૫	૨૦૧૮	૧૬	ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૧૮	(ક) કલમ ૩૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪પમા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૬	૨૦૨૧	૧૮	ગુજરાત ચિકિત્સા સંસ્થાઓરજિસ્ટ્રેશન ) (અને નિયમન અધિનિયમ, ૨૦૨૧.	(ક) કલમ ૪૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪પમા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૭	૨૦૨૩	૪	ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત અધિનિયમ, ૨૦૨૩	(ક) કલમ ૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪પમા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૮	૧૯૫૭	૩૩	ગુજરાતનો કોર્નિયા (આંખના ડોળા પરનો પારદર્શક પડદો) નાંખવા બાબતનો અધિનિયમ, ૧૯૫૭	(ક) કલમ ૭માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪પમા)ની કલમ ૨૯૭ની જોગવાઈઓ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪પમા)ની કલમ ૩૦૧ની જોગવાઈઓ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૮૯	૧૯૬૩	૩૭	ગુજરાતનો પ્રતિપાલક અધિકરણ અધિનિયમ, ૧૯૬૩	(ક) કલમ ૯માં, પેટા-કલમ (૨)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી:- “(૨) પ્રતિપાલક અધિકરણના દરેક સંચાલક અથવા અન્ય સેવક ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪પમા)ના પ્રકરણ ૧૨ મુજબ જાહેર સેવક ગણાશે”.
૯૦	૨૦૦૪	૪	ગુજરાત કોર્ટ-ફી અધિનિયમ, ૨૦૦૪	(ક) કલમ ૧૦માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪પમા)ની કલમો ૧૯૩ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪પમા)ની કલમો ૨૨૮ અને ૧૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.  (ખ) કલમ ૧૯માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની જોગવાઈઓ હેઠળ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ગ) કલમ ૨૦માં, ખંડ (૧૨)માં, “જાહેર સેવક (ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫-મા)માં વ્યાખ્યાયિત કર્યા મુજબ)” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “જાહેર સેવક (ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)માં વ્યાખ્યાયિત કર્યા મુજબ)” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p> <p>(ઘ) અનુસૂચિમાં,-</p> <p>(૧) નોંધ ૮માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની કોઈ કલમ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કોઈ કલમ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p> <p>(૨) નોંધ ૩૭માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની કલમ ૧૪૫ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૬૪ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p>
૯૧	૧૯૬૦	૧૧	ગુજરાત ઔષધ (નિયંત્રણ) અધિનિયમ, ૧૯૫૯	<p>(ક) કલમ ૨૩ના બદલે નીચેની કલમ મૂકવી:-</p> <p>“૨૩. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૬માં ગમે તે મજકૂર હોય તેમ છતાં, આ વતી રાજ્ય સરકાર દ્વારા વિશેષ રીતે સત્તા આપવામાં આવેલી હોય તેવા પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ માટે સદરહુ સંહિતાની કલમ ૨૬ હેઠળ તેમની સત્તાથી વધારાની કલમ ૨૧ હેઠળ અધિકૃત કોઈપણ સજા આપવાનું કાયદેસર રહેશે.”</p> <p>(ખ) કલમ ૩૦માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ની જોગવાઈઓ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p>
૯૨	૨૦૦૮	૧	ગુજરાત શૈક્ષણિક નવીકરણ આયોગ અધિનિયમ, ૨૦૦૮	<p>(ક) કલમ ૨૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p>
૯૩	૨૦૧૩	૨૦	ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ, ૨૦૦૬	<p>(ક) કલમ ૧૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫-મા)ની કલમો ૧૮૩ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮ અને ૧૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p> <p>(ખ) કલમ ૧૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p>
૯૪	૨૦૦૭	૧૨	ગુજરાત આકસ્મિક તબીબી સેવા અધિનિયમ, ૨૦૦૭	<p>(ક) કલમ ૫૭માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની કલમ ૨૦૦” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨૨૩” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(ખ) કલમ ૬૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૯૫	૨૦૧૩	૧૧	ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ, ૨૦૧૩	(ક) કલમ ૪૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ ૧૭૬ હેઠળ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૧૧ હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.  (ખ) કલમ ૪૬માં, પેટા-કલમ (૧)માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૯૬	૧૯૦૪	૧	ગુજરાત સામાન્ય કલમ અધિનિયમ, ૧૯૦૪	(ક) કલમ ૩માં,-  (૧) ખંડ (૧)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના કેન્દ્રીય અધિનિયમ ૪૫મા) મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા) મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.  (૨) ખંડ (૩૬)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, સન ૧૮૬૦ના ૪૫-મામાં વ્યાખ્યાયિત કર્યા મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)માં વ્યાખ્યાયિત કર્યા મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.  (ખ) કલમ ૨૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (કેન્દ્રીય અધિનિયમ)ની કલમો ૬૩ થી ૭૦ તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪નો ૨-જા)ની જોગવાઈઓ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૮(૧) થી ૮(૭) તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૯૭	૨૦૧૭	૨૫	ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭	(ક) કલમ ૬૭માં, પેટા-કલમ (૧૦)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી:-  “(૧૦) જડતી અને જમીને લગતી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની જોગવાઈઓ, શક્ય હોય ત્યાં સુધી, સદરહુ અધિનિયમની કલમ ૧૮૫ ની પેટા-કલમ (૫) માંનો “મેજિસ્ટ્રેટ” એ શબ્દ જ્યાં જ્યાં આવતો હોય ત્યાં તેને બદલે “કમિશનર” એ શબ્દ મૂકવો તે ફેરફારને અધીન રહીને, આ કલમ હેઠળની જડતી અને જમીને લાગુ પડશે.”  (ખ) કલમ ૬૮માં, પેટા-કલમ (૩)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની જોગવાઈઓને અધીન” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની જોગવાઈઓને અધીન” એ શબ્દો અને આંકડા મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ગ) કલમ ૭૦માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮ અને ૧૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p> <p>(ઘ) કલમ ૭૯માં, પેટા-કલમ (૧)માં, ખંડ (૯)માં. “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય તે છતાં” એ શબ્દો અને આંકડાને બદલે “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩માં ગમે તે મજકૂર હોય તે છતાં” એ શબ્દો અને આંકડા મૂકવા.</p> <p>(ચ) કલમ ૧૦૫-માં, પેટા-કલમ (૨)માં, “પણ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ના પ્રકરણ ૨૬ના હેતુઓ માટે ગણાશે નહિ અને સત્તામંડળ અથવા અપીલ સત્તામંડળ સમક્ષની દરેક કાર્યવાહી, ભારતનો ફોજદારી અધિનિયમની કલમો ૧૯૩ અને ૨૨૮ના અર્થ મુજબ અને કલમ ૧૯૬ના હેતુ માટે ન્યાયિક કાર્યવાહી હોવાનું ગણાશે” એ શબ્દો અને આંકડાને બદલે, “પણ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ના પ્રકરણ ૨૬ના હેતુઓ માટે ગણાશે નહિ અને સત્તામંડળ અથવા અપીલ સત્તામંડળ અથવા રાષ્ટ્રીય અપીલ સત્તામંડળ સમક્ષની દરેક કાર્યવાહી, ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમો ૨૨૮ અને ૨૬૭ના અર્થ મુજબ અને કલમ ૨૩૩ના હેતુ માટે ન્યાયિક કાર્યવાહી હોવાનું ગણાશે.” એ શબ્દો અને આંકડા મૂકવા.</p> <p>(છ) કલમ ૧૧૧માં,-</p> <p>(૧) પેટા-કલમ (૨)માં, ખંડ (ઘ)માં, “ભારતના પુરાવા અધિનિયમ, ૧૮૭૨ની કલમો ૧૨૩ અને ૧૨૪” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ની કલમો ૧૨૮ અને ૧૩૦” એ શબ્દો અને આંકડા મૂકવા.</p> <p>(૨) પેટા-કલમ (૪)ને બદલે નીચેની પેટા-કલમ મૂકવી:-</p> <p>“(૪) અપીલ ટ્રિબ્યુનલ સમક્ષની તમામ કાર્યવાહી, ભારતીય ન્યાય સંહિતાની કલમો ૨૨૮ અને ૨૬૭ના અર્થ મુજબ અને કલમ ૨૩૩ના હેતુઓ માટે ન્યાયિક કાર્યવાહી હોવાનું ગણાશે અને અપીલ ટ્રિબ્યુનલ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૧૫ અને પ્રકરણ ૨૬ના હેતુઓ માટે દીવાની કોર્ટ હોવાનું ગણાશે.”</p> <p>(૪) કલમ ૧૩૧માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ માં સમાવિષ્ટ જોગવાઈઓને” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩માં સમાવિષ્ટ જોગવાઈઓને” એ શબ્દો અને આંકડા મૂકવા.</p> <p>(૫) કલમ ૧૩૨માં, પેટા-કલમ (૪)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો અને આંકડા મૂકવા.</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(ટ) કલમ ૧૫૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૯૮	૧૯૫૫	૫૫	ગુજરાત ધોરીમાર્ગ અધિનિયમ, ૧૯૫૫	(ક) કલમ ૧૮માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ(સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૭૫ અને ૧૭૬” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૧૦ અને ૨૧૧” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.  (ખ) કલમ ૬૭માં, “ભારતનો ફોજદારી અધિનિયમના અર્થ મુજબ” એ શબ્દોને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૯૯	૧૯૬૩	૩૬	ગુજરાત હોમિયોપેથિક અધિનિયમ, ૧૯૬૩	(ક) કલમ ૧૬માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.  (ખ) કલમ ૨૦માં, પેટા-કલમ (૭)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૯, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.
૧૦૦	૧૯૫૫	૧૮	ગુજરાત ઈન્સાફી કામો (ના હવાલોનું નિયમન કરવા) બાબતનો અધિનિયમ, ૧૯૫૫	(ક) કલમ ૩માં, ખંડ (ખ)માં,-  (૧) “ભારતનો ફોજદારી અધિનિયમ, (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૪૯૭ હેઠળ ગુનાના સંબંધમાં કોઈ લગ્ન સંબંધિત બાબત અથવા કોઈ ન્યાયિક કાર્યવાહીના સંબંધમાં, નીચે સિવાયની કોઈપણ બાબત” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “નીચે સિવાયની કોઈપણ બાબત” એ શબ્દો મૂકવા.  (૨) પેટા-ખંડ (ગ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫-મા)ની કલમો ૩૫૪, ૩૬૬, ૩૬૬-ક, ૩૬૬-ખ, ૩૭૬, ૩૭૭ અથવા ૪૯૮” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫-મા)ની કલમો ૭૪, ૮૭, ૯૬, ૧૪૧, ૬૪ અથવા ૮૪” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.  (ખ) કલમ ૭માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૯૮ (સન ૧૯૯૮ના ૫-મા)ની કલમ ૯૯-ક-ની જોગવાઈઓ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૯૮ની જોગવાઈઓ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.  (ગ) અનુસૂચિ ૧માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૯૮ (સન ૧૯૯૮ના ૫મા)ની કલમ ૯૯-ક-માં” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૯૮માં” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧૦૧	૧૯૬૮	૧૦	ગુજરાત મેડિકલ કાઉન્સિલ અધિનિયમ, ૧૯૬૭	<p>(ક) કલમ ૧૪માં, પેટા-કલમ (૯)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫-મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p> <p>(ખ) કલમ ૧૫માં, પેટા-કલમ (૪)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p> <p>(ગ) કલમ ૨૨માં,-</p> <p>(૧) પેટા-કલમ (૧)માં, સ્પષ્ટીકરણમાં, ખંડ (ક)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫-મા)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p> <p>(૨) પેટા-કલમ (૭)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૨૮, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા.</p>
૧૦૨	૧૯૬૪	૬	ગુજરાત વૈદક વ્યવસાયીઓનો અધિનિયમ, ૧૯૬૩	<p>(ક) કલમ ૧૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, કૌંસ અને આંકડા મૂકવા;</p> <p>(ખ) કલમ ૨૦માં, પેટા-કલમ (૭)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૧૦૩	૧૯૭૯	૭	ગુજરાત ગૌણ વન-પેદાશ વ્યાપાર રાષ્ટ્રીયકરણ અધિનિયમ, ૧૯૭૯	<p>(ક) કલમ ૧૪માં, પેટા-કલમ (૫)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૩ના ૨૪)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૧૦૪	૨૦૦૧	૧૩	ગુજરાત મોટર સ્પિરિટ ઉપકર અધિનિયમ, ૨૦૦૧	<p>(ક) કલમ ૧૨માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૩ના ૨૪)ની” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૨૬માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૩ના ૨૪)ની” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>



અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				<p>(ગ) કલમ ૨૭માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)થી મળેલી” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)થી મળેલી” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ઘ) કલમ ૩૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૧૦૫	૧૯૬૪	૩૪	ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩	<p>(ક) કલમ ૧૮માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૧૭૧-ચ અથવા ૧૭૧-છ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૧૭૩ અથવા ૧૭૪ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ખ) કલમ ૭૩માં,-</p> <p>(૧) પેટા-કલમ (૧)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(૨) પેટા-કલમ (૨) કમી કરવી.</p> <p>(ગ) કલમ ૮૮માં, ખંડ (ક)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ના પ્રકરણ ૩૪ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ના પ્રકરણ ૨૭ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ઘ) કલમ ૨૧૧માં, પેટા-કલમ (૧)માં, “ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૧૭૩ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨૦૭ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p> <p>(ચ) કલમ ૧૮૦માં, ખંડ (ખ)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા) હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા) હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૧૦૬	૨૦૦૩	૯	ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૩	<p>(ક) કલમ ૪૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.</p>
૧૦૭	૧૯૪૮	૬૧	ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭.	<p>(ક) કલમ ૫માં, ખંડ (ગ)માં, પેટા-ખંડ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૮ (સન ૧૯૮૮ના ૫મા)ની કલમ ૧૧૮ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૩૬ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;</p>

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(ખ) કલમ ૭૭માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ગ) કલમ ૪૦૭-માં, પેટા-કલમ (દ)માં, ખંડ (ઘ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૧૮૩ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૦૮	૨૦૦૬	૧૮	ગુજરાત વ્યવસાયી બાંધકામ ઈજનેર અધિનિયમ, ૨૦૦૬	(ક) કલમ ૩૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૦૯	૨૦૦૮	૩	ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) અધિનિયમ, ૨૦૦૭	(ક) કલમ ૧૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૧૦	૨૦૦૮	૨	ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) અધિનિયમ, ૨૦૦૭	(ક) કલમ ૧૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૧૧	૧૯૯૧	૧૨	ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત અધિનિયમ, ૧૯૯૧	(ક) કલમ ૩માં, સ્પષ્ટીકરણમાં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૧૪૬માં આપેલ અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૧૯૧ (૧)માં આપેલ અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૭માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૧૮૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૧૨	૨૦૨૩	૧૫	ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૨૩	(ક) કલમ ૧૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧૧૩	૧૯૯૨	૪	ગુજરાત જાહેર બાંધકામ કરાર સંબંધી તકરાર લવાદી ટ્રિબ્યુનલ અધિનિયમ, ૧૯૯૨	(ક) કલમ ૧૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૯, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૧૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૧૪	૨૦૦૬	૧૬	ગુજરાત લગ્ન-નોંધણી અધિનિયમ, ૨૦૦૬	(ક) કલમ ૧૯માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૧૫	૨૦૧૮	૧	ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળ અધિનિયમ, ૨૦૧૮.	(ક) કલમ ૨૮માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૧૬	૧૯૮૪	૪	ગુજરાત ગ્રામ વિકાસ ઉપકર અધિનિયમ, ૧૯૮૪	(ક) કલમ ૧૨માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨૪)ની” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૧૭	૧૯૭૩	૧૮	ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨	(ક) કલમ ૩૯માં, પેટા-કલમ (દ)માં, ખંડ (ઘ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૯, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૪૯માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૧૮	૨૦૧૭	૨૦	ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) અધિનિયમ, ૨૦૧૭	(ક) કલમ ૮માં, પેટા-કલમ (૩)માં, ખંડ (ખ)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩, ૨૧૯ અને ૨૨૮ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૯, ૨૫૭ અને ૨૬૭ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૧૯માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧૧૯	૧૯૭૩	૧૧	ગુજરાત ગંદા વસવાટ વિસ્તાર (સુધારણા, નાબૂદી અને પુનર્વિકાસ) અધિનિયમ, ૧૯૭૩.	(ક) કલમ ૫૪માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૨૦	૨૦૧૧	૧૮	ગુજરાત રાજ્ય ફિઝિયોથેરેપિ કાઉન્સિલ અધિનિયમ, ૨૦૧૧	(ક) કલમ ૩૭માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨૪) હેઠળ વ્યાખ્યાયિત કર્યા પ્રમાણેના” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા) હેઠળ વ્યાખ્યાયિત કર્યા પ્રમાણેના” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ખ) કલમ ૩૮માં, ખંડ (ધ)માં, “ભારતનો પુરાવા અધિનિયમ, ૧૯૭૨ (સન ૧૯૭૨નો ૧લા) હેઠળ તજજ્ઞ તરીકે” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૭મા) હેઠળ તજજ્ઞ તરીકે” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ગ) કલમ ૪૪માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨૪)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા;  (ઘ) કલમ ૪૭માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૨૧	૨૦૧૭	૧	ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ અધિનિયમ, ૨૦૧૬	(ક) કલમ ૨૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૨૨	૨૦૧૪	૫	ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ અધિનિયમ, ૨૦૧૩.	(ક) કલમ ૧૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૨૩	૨૦૦૭	૨૦	ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૭	(ક) કલમ ૪૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૨૪	૧૯૭૬	૨૭	ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬	(ક) કલમ ૧૧૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૯૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧૨૫	૨૦૧૫	૯	ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝ અધિનિયમ, ૨૦૧૫	(ક) કલમ ૩૫માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા.
૧૨૬	૨૦૦૫	૧	ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩	(ક) કલમ ૬૭માં, પેટા-કલમ (૭)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની જોગવાઈઓ” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;  (ખ) કલમ ૮૨માં, પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમો ૧૯૩ અને ૨૨૮ના અર્થ મુજબ અને કલમ ૧૯૬ના હેતુઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમો ૨૨૮ અને ૨૬૭ના અર્થ મુજબ અને કલમ ૨૩૩ના હેતુઓ માટે” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;  (ગ) કલમ ૮૭માં,-  (૧) પેટા-કલમ (૧)માં, “મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટથી ઉતરતા દરજ્જાની” એ શબ્દોને બદલે, “જ્યુડિશલ મેજિસ્ટ્રેટથી ઉતરતા દરજ્જાની” એ શબ્દો મૂકવા;  (૨) પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;  (ઘ) કલમ ૮૮માં, પેટા-કલમ (૨)માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ના ૨જા)થી મળેલી” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)થી મળેલી” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;  (ચ) કલમ ૯૧માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;  (છ) કલમ ૯૨માં, પેટા-કલમ (૨)માં, ખંડ (ક)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા) હેઠળ કોઈ ફોજદારી કામ” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા) હેઠળ કોઈ ફોજદારી કામ” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;  (જ) કલમ ૯૫માં,-  (૧) પેટા-કલમ (૨)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા) હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા) હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌસ મૂકવા;

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
				(૨) પેટા-કલમ (૪)માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫મા) હેઠળના” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા) હેઠળના” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૨૭	૧૯૭૩	૧૫	ગુજરાત પશુચિકિત્સક અધિનિયમ, ૧૯૬૯	(ક) કલમ ૧૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૨૮	૨૦૧૦	૮	ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન, ગુજરાત અધિનિયમ, ૨૦૧૦	(ક) કલમ ૪૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૨૯	૨૦૧૩	૫	ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ અધિનિયમ, ૨૦૧૨	(ક) કલમ ૩૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૩૦	૨૦૦૭	૨૧	કડી સર્વ વિશ્વવિદ્યાલય અધિનિયમ, ૨૦૦૭	(ક) કલમ ૩૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૩૧	૨૦૦૫	૨૫	શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૫	(ક) કલમ ૩૭માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૩૨	૨૦૧૯	૩૩	સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન અધિનિયમ, ૨૦૧૯.	(ક) કલમ ૫૦માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૩૩	૨૦૧૧	૨૨	સ્વર્ણિમ ગુજરાત રમતગમત યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૧૧.	(ક) કલમ ૪૨માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ ૨ (૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૩૪	૧૯૬૫	૨૫	ગુજરાતનો પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ વિષયક સ્થળો અને અવશેષો બાબતનો અધિનિયમ, ૧૯૬૫	(ક) કલમ ૩૩માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૯૮ (સન ૧૯૯૮ના ૫મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં”, એ શબ્દોને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો મૂકવા.

અનુ-ક્રમાંક	વર્ષ	અધિનિયમ ક્રમાંક	ટૂંકી સંજ્ઞા	સુધારો
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧૩૫	૧૯૭૨	૨૩	ગુજરાત આવશ્યક સેવા જાળવણી બાબત અધિનિયમ, ૧૯૭૨	(ક) કલમ ૮માં, “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૮૮ (સન ૧૮૮૮ના ૫મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં”, એ શબ્દોને બદલે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં” એ શબ્દો મૂકવા.
૧૩૬	૨૦૧૩	૧૧	ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ, ૨૦૧૩	(ક) કલમ ૩૫માં, “મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટની” એ શબ્દોને બદલે, “મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટની” એ શબ્દો મૂકવા; (ખ) કલમ ૪૨-માં, “ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ ૧૭૬ હેઠળ” એ શબ્દો અને આંકડાને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫-મા)ની કલમ ૧૭૫ હેઠળ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા; (ગ) કલમ ૪૬માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫-મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫-મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.
૧૩૭	૨૦૧૪	૫	ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ અધિનિયમ, ૨૦૧૩	(ક) કલમ ૧૩માં, “ભારતનો ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫-મા)ની કલમ ૨૧ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસને બદલે, “ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫-મા)ની કલમ ૨(૨૮)ના અર્થ મુજબ” એ શબ્દો, આંકડા અને કૌંસ મૂકવા.

### નિવેદન

સંસદે, ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૫મો), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૬મો) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૭મો)-ને અધિનિયમિત કર્યા છે અને ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦નો ૪૫મો), ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૭૩ (સન ૧૮૭૩નો ૨જો) અને ભારતના પુરાવા અધિનિયમ, ૧૮૭૨ (સન ૧૮૭૨નો ૧લો) રદ કર્યા છે. નવા અધિનિયમિત કરાયેલા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ તારીખ: ૧લી જુલાઈ, ૨૦૨૪થી અમલમાં આવશે.

એવું જણાયું છે કે ગુજરાત રાજ્ય દ્વારા કરાયેલા અસંખ્ય અધિનિયમોમાં ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૭૩ અને ભારતના પુરાવા અધિનિયમ, ૧૮૭૨-ના ઉલ્લેખો છે.

ગુજરાત સામાન્ય કલમ અધિનિયમ, ૧૯૦૪-ની કલમ ૯માં એવી જોગવાઈ છે કે, આ અધિનિયમથી અથવા આ અધિનિયમના પ્રારંભ પછી કરેલા કોઈપણ મુંબઈ અધિનિયમ [ગુજરાત અધિનિયમ]થી અગાઉના કોઈ અધિનિયમની કોઈપણ જોગવાઈને ફેરફાર સાથે કે ફેરફાર વગર રદ કરીને, પુનઃઅધિનિયમિત કરવામાં આવે ત્યારે, એ રીતે રદ કરેલી જોગવાઈ સંબંધી બીજા કોઈ અધિનિયમ અથવા લેખમાંના ઉલ્લેખો, કોઈ બીજો ઈરાદો દેખાતો ન હોય તો, એ રીતે પુનઃઅધિનિયમિત કરવામાં આવેલી જોગવાઈ સંબંધી છે એમ સમજવું. તેથી, સંસદે, ભારતનો ફોજદારી અધિનિયમ, ૧૮૬૦, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૮૭૩ તથા ભારતના પુરાવા અધિનિયમ, ૧૮૭૨-ને રદ કર્યા હોવાથી અને તેને, ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ના સ્વરૂપે પુનઃઅધિનિયમિત કર્યા હોવાથી. ગુજરાત સામાન્ય કલમ અધિનિયમ, ૧૯૦૪-ની કલમ ૯(ની જોગવાઈ) લાગુ પડે છે અને ગુજરાત અધિનિયમોમાંના રદ કરાયેલા અધિનિયમોનો ઉલ્લેખ, હવે, નવા પુનઃઅધિનિયમિત કરાયેલા અધિનિયમોનો ઉલ્લેખ ગણાશે. તેમ છતાં હજી પણ, રદ કરાયેલા અધિનિયમોની જોગવાઈઓના ઉલ્લેખો પણ હોવાથી, ગુજરાત અધિનિયમોમાંના સદરહુ રદ કરાયેલા અધિનિયમોની સંબંધિત જોગવાઈ અને પુનઃઅધિનિયમિત કરાયેલા અધિનિયમોની નવી જોગવાઈ અંગેની અસ્પષ્ટતા અથવા ગૂંચવણ દૂર કરવા માટે પૂરેપૂરી સાવધાની દાખવવામાં આવી છે.

નવા પુનઃઅધિનિયમિત કરાયેલા અધિનિયમો, તારીખ: ૧લી જુલાઈ, ૨૦૨૪થી અમલમાં આવવાના હોવાથી, ગુજરાત અધિનિયમોની જોગવાઈઓમાંના ઉલ્લેખો અને તેમાંના રદ કરાયેલા અધિનિયમો-ને, નવા અધિનિયમોની જોગવાઈઓ અને નામોથી બદલવા જરૂરી જણાયું છે.

ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી, ઉપર્યુક્ત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે, સદરહુ અધિનિયમો સુધારવા ગુજરાત કાયદા (જોગવાઈઓના સુધારા) વટહુકમ, ૨૦૨૪ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ગાંધીનગર,

તારીખ: ૨૬મી જૂન, ૨૦૨૪.

આચાર્ય દેવવ્રત,

ગુજરાતના રાજ્યપાલ.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

અશ્વિની કુમાર,

સરકારના અગ્ર સચિવ.

